Rainath: We don't believe in giving sermons to nations in need of aid

PRESSTRUSTOFINDIA BENGALURU, FEBRUARY 14

INDIA DOES not believe in giving "sermons or cut-and-dried" solutions to countries in need of assistance and holds that nations with superior military powers do not have the right to dictate solutions to others, Defence Minister Rajnath Singh said on Tuesday in an apparent reference to China's assertive behaviour.

In an address to his counterparts and deputy defence ministers from around 30 countries at Aero India, Singh said India has always stood for a rules-based global order in which the primordial instinct of "might being right" is replaced by fairness, respect and equality amongst all sovereign nations.

Without naming China or any other country, Singh said the "top-down approach" towards solving problems has never been sustainable, adding often it leads to "debt trap, reaction from the local population and conflict". While referring to India's emphasis on collective approach, Singh talked about how the Covid-19 pandemic originated in "one country" and how in no time, it had a devastating impact on the whole world, adding the crisis once again underscored the point that "we are all in the same boat and we either sink or swim together".

In the conclave named SPEED (Shared Prosperity through Enhanced Engagements in Defence), Singh also called for united efforts to counter pressing challenges like terrorism and said collective security has become "sine-qua-non" for overall development and prosperity of nations. To counter the security threats, Singh underlined the need for devising new strategies, adding India does not believe in dealing with such security issues in the "old paternalistic or the neo-colonial paradigms".

"We do not believe in giving sermons or cut-and-dried solutions, which do not respect the national values and constraints of the countries in need of assistance. Rather, we support the capacity building of our partner countries, so that they may chart out their own destiny," he added.

Date and place of opening tenders

invitation to tender, please refer below:

Tender forms available at

Place: Anjar

IIT-Madras cancels classes for a day after night-long protest over research student's suicide protest against the callous han- and academic work on Monday. addressed the student gathering cide on Sunday afternoon in a hos- campus Sunday. The student was death that sparked the protest against the callous han- and academic work on Monday.

ARUN JANARDHANAN CHENNAI, FEBRUARY 14

FOLLOWING Anight-long student

dling of a student's suicide and an attempted suicide by another student on the campus Sunday, IIT-Madras decided to cancel classes The unusual decision to declare Monday a "non-instructional day" was made after the institute's director Kamakoti Veezhinathan

Possession Notice

(For Immovable Property)

and promised to take action.

A second-year research student in the electrical engineering department allegedly died by suitel room on the campus. According to reliable sources, a second, unconnected suicide attempt was also reported on the rescued and is currently under treatment at a hospital in Chennai. It was the administration's callous handling of the first student's

The students asked the administration to create a panel of experts from outside to study the mental health of the students.

Rajkot Nagarik Sahakari Bank Ltd.

(Multistate Scheduled Bank)

R.O. & H.O.: "Arvindbhai Maniar Nagarik Sevalay", 150' Ring Road, Nr. Raiya Circle, Rajkot. Ph. 2555716 The undersigned being the authorized officer of Rajkot Nagarik Sahakari Bank Ltd., H.O. Rajkot under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security interest Act, 2002 Section 13(2) and in exercise of powers conferred under the Security Interest (Enforcement) Rules, 2002 Issued a demand notice dated 22/03/2022 by Regd.A.D. Post calling upon the borrower Makvana Kailasbhai Rameshbhai to repay the amount mentioned in the notice being Rs.5,05,459=00 (Rupees Five Lakh Five Thousand Four Hundred Fifty Nine Only) and interest thereon due from 01/03/2022 within 60 days from the date of receipt of the said notice. The borrower having failed to repay the amount, notice is hereby given to the borrower, guarantors and the public in general that the undersigned has taken possession of Property described herein below on 12/02/2023 through the Court Commissioner, in pursuance of the Order Dt.29/12/2022 issued by the Hon. Chief Judicial Magistrate Bhavnagar under section 14 of the SARFAESI Act-2002. The borrower in particular, the guarantors and the public in general is hereby cautioned not to deal with the following property and any dealing with this property will be subject to the charge of Rajkot Nagarik Sahakari Bank Ltd., Rajkot for an amount outstanding as on 31/01/2023 Rs.5,20,895=00 (Rupees Five Lakh Twenty Thousand Eight Hundred Ninety Five Only) + interest thereon due from 01/02/2023.

Description of immovable property

Immovable Property Situated in Bhavnagar Dist., Sub-Dist. Bhavnagar at area of Known as "Anandnagar" old vadvana Revenue Survey No.53,54 Constructed in the scheme of 36- LIG Flat by Gujarat Housing Board which have Flat No. L/110 on Ground Floor which have admeasuring Built-Up area 30-10 Sq. Meter acquired vide Regd. sale deed No.766, Dated 14/02/2020 in the name of Kailashbhai Rameshbhai Makvana and bounded by as under;

North: Flat No.111 West: Open Land (Short Address:- R.S. No.53-54, Flat No.L/110, Ground Floor, 36 LIG Gujarat Housing Board, Anand Nagar Colony, Bhavnagar)

Dt. 14/02/2023 Rajkot.

Authorized Officer, Rajkot Nagarik Sahakari Bank Ltd., H.O., Recovery Dept., Rajkot.

SHREE AJIT PULP AND PAPER LIMITED

Regd. Office: Survey No. 239, Near Morai Railway Crossing, Village Salvav, via-Vapi-396191 E-mail: investors@shreeajit.com, Website: www.shreeajit.com, Tel.no. 0260-6635700, Fax no. 0260-2437090. CIN: L21010GJ1995PLC025135 Extract of Consolidated Unaudited Financial Results for the Quarter and Nine months ended 31st December, 2022

| | | | | (₹ in Lakh) | |
|---------|--|-----------------------------------|-----------------------------------|--|--|
| Sr. No. | Particulars | 3 months ended (31/12/2022) | 9 months ended (12/12/2022) | Corresponding 3 months ended (31/12/2021) | |
| | | Unaudited | Unaudited | Unaudited | |
| 1 | Total Income from operations | 8,662.09 | 29,612.77 | 10,678.53 | |
| 2 | Profit before Tax | 1,722.27 | 2,410.11 | 748.12 | |
| 3 | Profit for the period | 1,541.42 | 2,028.36 | 535.35 | |
| 4 | Total Comprehensive Income for the period | 1,543.16 | 2,033.03 | 534.41 | |
| 5 | Equity Share Capital | 535.67 | 535.67 | 535.67 | |
| 6 | Other Equity | | | | |
| 7 | Earnings per share Basic and Diluted (₹-not annualized) (Face value of ₹ 10 per share) | 28.78 | 37.87 | 9.99 | |

The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with the Stock Exchange under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Standalone and Consolidated Quarterly Financial Results are available on the Company's websit www.shreeajit.com" and Bombay Stock Exchange's website "www.bseindia.com"

| The summarised standalone financial results of the company are as below :- {₹ in Lak! | | | | | |
|--|-----------------------------------|-----------------------------------|--|--|--|
| Particulars | 3 months ended (31/12/2022) | 9 months ended (12/12/2022) | Corresponding 3 months ended (31/12/2021) | | |
| | Unaudited | Unaudited | Unaudited | | |
| Total Income from operations | 8,662.09 | 29,612.77 | 10,678.53 | | |
| Profit before Tax | 654.64 | 1,363.10 | 738.13 | | |
| Profit for the period | 473.99 | 981.93 | 525.55 | | |
| Total Comprehensive Income for the period | 475.73 | 986.60 | 524.61 | | |

For and on Behalf of Board of Directors

Gautam D Shah Place :- Vapi

Date :- 14 February, 2023

Chairman and Managing Director DIN: 00397319

Fax: +91-79-26560649, Toll Free No.: 18002335300

Regional Off.: Netaji Marg, Nr. Mithakhali

Six Roads, Ellisbridge, Ahmedabad-6.

Website: www.bandhanbank.com

SALE NOTICE CUM INVITATION TO TENDER

Sale notice cum invitation to tender is hereby given to the public in general and in particular to the borrower(s) that the below described mmovable property which is mortgaged to erstwhile GRUH (Now "the Bandhan Bank") is put for sale. The specific details of the properties, which are intended to be sold, are enumerated hereunder in the SCHEDULE:

| Name of borrower(s), Loan Account No., Date of Possession & Tender Reference No. | Description of the property to be sold (Secured Asset) | Secured Debt as on date of demand notice and as on 31.12.2022 which includes amount paid by the borrowers from the date of demand notice till date, if any, with further interest, costs, charges etc. | Reserve price and EMD payable | | |
|--|---|--|---|--|--|
| Mr. Bhim MohanRam Singh Mrs. Rani Bhim Singh 208/3830 11.10.2017 208-728 | All that piece and parcel of the immovable property situated at Revenue survey No.260/3, Plot no 78, Gayatri Township, Village: Varsamedi, Tal: Anjar, Dist: Kutch. | Rs. 8,54,572.17/- as on 10.02.2017 11,44,397/-as on 31.12.2022 | Rs.4,43,000/- EMD 10% of the offer price. | | |
| The date of the tender opening and ot | her details for the above mentioned propert | y is as mentioned below . | | | |
| Tender form fee | m fee Rs.100/- per tender for the above property, payable by Banker's Cheque/Demand draft favoring "Bandhan Bank Limited" (non-refundable) | | | | |
| Date of inspection of property | 21.02.2023 between 10.00 A.M. to 5. | 00 P.M. | | | |
| Last date and time for receiving tender | 02.03.2023 up to 05:00 P.M. at Bandhan Bank Ltd.GRUH Centre1st Floor, Plot No. 5,Sector 1-A, Mamlatdar Office Road,Gandhidham - 370201.Gujarat | | | | |
| Earnest Money Deposit (EMD) payable | 10% of the offer price is to be paid along with tender by way of Bankers Cheque/Demand Draft favoring at "Bandhan Bank Limited" | | | | |

Name of contact person(s): Mehul Kulinbhai Buch:9327918432, Mahendra Gadhvi :9978484414 The sale of the property will be on "AS IS WHERE IS BASIS", "AS IS WHAT IS BASIS", "NO RECOURSE BASIS" and "WHATEVER THERE IS BASIS". The properties may not be sold below the Reserve Price. The Bank submits that we have not received any intimation about litigations, disputes filed or pending against the aforesaid property mortgaged in favor of the Bank. The borrowers'/mortgagors' can redeem the mortgage till the date of sale confirmation as provided under section 13(8) of the SARFAESI Act. For detailed terms and conditions of the sale notice cun

Gandhidham Branch as stated hereinabove.

Road, Gandhidham - 370201, Gujarat

The tenders shall be opened on 06.03.2023 By Authorised Officer of Bandhan Bank at

Bandhan Bank Limited-Gandhidham branch, 1st Floor, Plot No. 5, Sector 1-A, Mamlatdar Office

Terms and conditions:

- 1. Interested parties may send/submit their sealed tenders for the aforesaid property in a sealed cover superscribed as "Offer for purchase of Property" as mentioned in the schedule above along with Earnest Money Deposit (EMD) as mentioned in column No.4 above, by
- Bankers Cheque / Demand Draft favoring "Bandhan Bank Limited" which is refundable, in case the bid is not successful. 2. All the bidders whose bids are at or above the reserve price and valid and qualify up to the standards set up by the Committee shall be intimated in writing within a week from the date of opening of the tender. The highest valid bidder whose bid is accepted shall be offered to purchase the property and he shall have to complete the remaining formalities within the given time frame.
- 3. On acceptance of the offer from the highest bidder by the Authorized Officer, the highest bidder shall deposit the balance amount aggregating to 25% of the bid amount of the sale price immediately i.e. on the same day or not later than the next working day on receipt of the sale confirmation letter and the remaining bid amount within 15 days of the confirmation of sale of the property or such extended period as may be agreed upon in writing between the purchaser and the Bank. Payment shall be made only in the form of Bankers Cheque / Demand Draft favoring "Bandhan Bank Limited".

4. In case the successful bidder either fails to deposit 25% of bid amount immediately on the acceptance of the sale confirmation letter or

- fails to pay the remaining amount within 15 days or any such extended period, the 10% EMD amount of the offer price and / or the balance amount aggregating to 25% of the bid amount made by the bidder, if any, shall be forfeited by the Authorized Officer without any further correspondence and the property shall be sold again in accordance with provisions of the SARFAESI Act and the Rules made 5. The sale will be on "AS IS WHERE IS BASIS" "AS IS WHAT IS BASIS" and "NO RECOURSE BASIS". The details of the encumbrances as
- the expenses, charges, fees and other incidental expenses including the encumbrances as stated above in connection with the sale and issuance of Sale Certificate including applicable stamp duty, registration charges, etc. shall be borne and paid by the Purchaser.

regards electricity dues, municipality taxes and / or society dues etc., if any, shall be made available on the date of inspection. Other than the above, Authorized Officer is not aware of any other encumbrances other than as stated above or otherwise over the said property. All

- 6. Where the amount of dues of GRUH (Now "the Bandhan Bank" as stated in aforesaid paragraph) together with all costs, charges and expenses incurred by it is tendered by the borrowers / mortgagor to GRUH (Now "the Bandhan Bank" as stated in aforesaid paragraph) at any time before the date of publication of notice inviting tender from public or before the date of execution of the sale certificate, no further step shall be taken for the sale of the secured asset to the bidder.
- 7. The Authorized Officer has the absolute right to accept or reject any bid without assigning any reason whatsoever, at any point of time. 8. The sale will be subject to confirmation by Bandhan Bank Limited.
- Date: 15/02/2023

Bandhan Bank Limited Authorised Officer



Regional Off.: Netaji Marg, Nr. Mithakhali Six Roads, Ellisbridge, Ahmedabad-6.

Fax: +91-79-26560649, Toll Free No.: 18002335300 Website: www.bandhanbank.com

SALE NOTICE CUM INVITATION TO TENDER

Sale notice cum invitation to tender is hereby given to the public in general and in particular to the borrower(s) that the below described immovable property which is mortgaged to erstwhile GRUH (Now "the Bandhan Bank") is put for sale. The specific details of the properties, which are intended to be sold, are enumerated hereunder in the SCHEDULE:

| Name of borrower(s), Loan Account No., Date of Possession & Tender Reference No. | Description of the property to be sold (Secured Asset) | Secured Debt as on date of demand notice and as on 31.12.2022 which includes amount paid by the borrowers from the date of demand notice till date, if any, with further interest, costs, charges etc. | Reserve price and EMD payable | | | |
|--|--|--|---|--|--|--|
| Mr.Manishbhai Natubhai Makwana Mrs.Dharmishthaben Manishbhai Makwana 206/4801 21.01.2021 206-1041 | All that piece and parcel of the immovable property situated at Revenue Survey No. 158 Part Plot No. 32 Paiki., Yogi Nagar, Amrapara, Babra Amreli Gujarat – 365421. | Rs.8,85,418,23 as on 25,09,2019 Rs.14,26,501/- as on 31.12.2022 | Rs.9,50,000/- EMD 10% of the offer price. | | | |
| The date of the tender opening and other | ner details for the above mentioned propert | y is as mentioned below. | | | | |
| Tender form fee | Rs.100/- per tender for the above property, payable by Banker's Cheque/Demand draft favoring "Bandhan Bank Limited" (non-refundable) | | | | | |
| Date of inspection of property | 21.02.2023 between 10.00 A.M. to 5. | 21.02.2023 between 10.00 A.M. to 5.00 P.M. | | | | |
| Last date and time for receiving tender | 02.03.2023 up to 05:00 P.M. at Bandhan Bank Ltd.GRUH CentreGround Floor, Kalyan Nagar Society, Opp S.T. Division, Varasada Road, Amreli-365601.Gujarat | | | | | |
| Earnest Money Deposit (EMD) payable | 10% of the offer price is to be paid along with tender by way of Bankers Cheque/Demand Draft favoring at "Bandhan Bank Limited" | | | | | |
| Date and place of opening tenders | The tenders shall be opened on 06.03.2023 By Authorised Officer of Bandhan Bank at Amreli Branch as stated hereinabove. | | | | | |
| Tender forms available at | Bandhan Bank Limited- Amreli Branch, Ground Floor, Kalyan Nagar Society, Opp S.T. Division, Varasada Road, Amreli-365601.Gujarat Name of contact person(s): Mr.Kaushik Joshi: 9737391111,Mr.Jayesh Mehta:8401754075 | | | | | |

The sale of the property will be on "AS IS WHERE IS BASIS", "AS IS WHAT IS BASIS", "NO RECOURSE BASIS" and "WHATEVER THERE IS BASIS". The properties may not be sold below the Reserve Price. The Bank submits that we have not received any intimation about litigations. disputes filed or pending against the aforesaid property mortgaged in favor of the Bank. The borrowers'/mortgagors' can redeem the mortgage till the date of sale confirmation as provided under section 13(8) of the SARFAESI Act. For detailed terms and conditions of the sale notice cun invitation to tender, please refer below:

Terms and conditions:

- 1. Interested parties may send/submit their sealed tenders for the aforesaid property in a sealed cover superscribed as "Offer for purchase of Property" as mentioned in the schedule above along with Earnest Money Deposit (EMD) as mentioned in column No.4 above, by Bankers Cheque / Demand Draft favoring "Bandhan Bank Limited" which is refundable, in case the bid is not successful
- 2. All the bidders whose bids are at or above the reserve price and valid and qualify up to the standards set up by the Committee shall be intimated in writing within a week from the date of opening of the tender. The highest valid bidder whose bid is accepted shall be offered to purchase the property and he shall have to complete the remaining formalities within the given time frame.
- 3. On acceptance of the offer from the highest bidder by the Authorized Officer, the highest bidder shall deposit the balance amount aggregating to 25% of the bid amount of the sale price immediately i.e. on the same day or not later than the next working day on receipt of the sale confirmation letter and the remaining bid amount within 15 days of the confirmation of sale of the property or such extended period as may be agreed upon in writing between the purchaser and the Bank. Payment shall be made only in the form of Bankers Cheque / Demand Draft favoring "Bandhan Bank Limited".
- In case the successful bidder either fails to deposit 25% of bid amount immediately on the acceptance of the sale confirmation letter or fails to pay the remaining amount within 15 days or any such extended period, the 10% EMD amount of the offer price and / or the balance amount aggregating to 25% of the bid amount made by the bidder, if any, shall be for any further correspondence and the property shall be sold again in accordance with provisions of the SARFAESI Act and the Rules made
- 5. The sale will be on "AS IS WHERE IS BASIS" "AS IS WHAT IS BASIS" and "NO RECOURSE BASIS". The details of the encumbrances as regards electricity dues, municipality taxes and / or society dues etc., if any, shall be made available on the date of inspection. Other than the above, Authorized Officer is not aware of any other encumbrances other than as stated above or otherwise over the said property. All the expenses, charges, fees and other incidental expenses including the encumbrances as stated above in connection with the sale and issuance of Sale Certificate including applicable stamp duty, registration charges, etc. shall be borne and paid by the Purchaser.
- Where the amount of dues of GRUH (Now "the Bandhan Bank" as stated in aforesaid paragraph) together with all costs, charges and expenses incurred by it is tendered by the borrowers / mortgagor to GRUH (Now "the Bandhan Bank" as stated in aforesaid paragraph) at any time before the date of publication of notice inviting tender from public or before the date of execution of the sale certificate, no further step shall be taken for the sale of the secured asset to the bidder
- The Authorized Officer has the absolute right to accept or reject any bid without assigning any reason whatsoever, at any point of time.
- 8. The sale will be subject to confirmation by Bandhan Bank Limited.

Date: 15/02/2023 Bandhan Bank Limited



Regional Off.: Netaji Marg, Nr. Mithakhali Six Roads, Ellisbridge, Ahmedabad-6. Fax: +91-79-26560649, Toll Free No.: 18002335300 Website: www.bandhanbank.com

SALE NOTICE CUM INVITATION TO TENDER

Sale notice cum invitation to tender is hereby given to the public in general and in particular to the borrower(s) that the below described immovable property which is mortgaged to erstwhile GRUH (Now "the Bandhan Bank") is put for sale. The specific details of the properties, which are intended to be sold, are enumerated hereunder in the SCHEDULE: Name of borrower(s), Loan

Description of the property to be sold Secured Debt as on date of demand Reserve price

| Account No., Date of Possession & Tender Reference No. | (Secured Asset) | and EMD payable | | | |
|--|--|---|---|--|--|
| Mr.Pratikbhai Jayeshbhai Soni Mr.Jayeshbhai Govindbhai Soni 213/1186 19.05.2022 213-1207 | All that piece and parcel of the immovable property situated at Revenue Survey No. 606 Paiki 3, Plot No. 23 Paiki North side, Uma Park- 3, B/h Rachit Nagar, Paliyad Road, Botad-364710 | Rs.9,29,885.67 as on 02.09.2021 Rs.11,71,538.10 as on 13.02.2023 | Rs.6,77,000/- EMD 10% of the offer price. | | |
| The date of the tender opening and | other details for the above mentioned property | y is as mentioned below. | | | |
| Tender form fee | Rs.100/- per tender for the above property, payable by Banker's Cheque/Demand draft favoring "Bandhan Bank Limited" (non-refundable) | | | | |
| Date of inspection of property | 21.02.2023 between 10.00 A.M. to 5.00 P.M. | | | | |
| Last date and time for receiving tender | 02.03.2023 up to 05:00 P.M. at Bandhan Bank Ltd.GRUH Centre 1st Floor, Anand Dham Complex, Opp. Sunil Gas Agency, Mastram Mandir Road, Botad - 364710.Gujarat | | | | |
| Earnest Money Deposit (EMD) payable | 10% of the offer price is to be paid along with tender by way of Bankers Cheque/Demand Draft favoring at "Bandhan Bank Limited" | | | | |
| Date and place of opening tenders | The tenders shall be opened on 06.03.2023 By Authorised Officer of Bandhan Bank at Botad Branch as stated hereinabove. | | | | |
| Tender forms available at | Bandhan Bank Limited- Botad branch , 1st Floor, Anand Dham Complex,Opp. Sunil Gas Agency, Mastram Mandir Road,Botad - 364710.Gujarat Name of contact person(s): Mr.Rikinkumar Sheth: 9998498943, Mr.Nitin Nathalal Unadkat: 9327188001 | | | | |

The sale of the property will be on "AS IS WHERE IS BASIS", "AS IS WHAT IS BASIS", "NO RECOURSE BASIS" and "WHATEVER THERE IS BASIS". The properties may not be sold below the Reserve Price. The Bank submits that we have not received any intimation about litigations disputes filed or pending against the aforesaid property mortgaged in favor of the Bank. The borrowers'/mortgagors' can redeem the mortgage till the date of sale confirmation as provided under section 13(8) of the SARFAESI Act. For detailed terms and conditions of the sale notice cur invitation to tender, please refer below:

Terms and conditions:

- 1. Interested parties may send/ submit their sealed tenders for the aforesaid property in a sealed cover superscribed as "Offer for purchase o Property" as mentioned in the schedule above along with Earnest Money Deposit (EMD) as mentioned in column No.4 above, by Bankers Cheque / Demand Draft favoring "Bandhan Bank Limited" which is refundable, in case the bid is not successful.
- 2. All the bidders whose bids are at or above the reserve price and valid and qualify up to the standards set up by the Committee shall be intimated in writing within a week from the date of opening of the tender. The highest valid bidder whose bid is accepted shall be offered to purchase the property and he shall have to complete the remaining formalities within the given time frame.
- On acceptance of the offer from the highest bidder by the Authorized Officer, the highest bidder shall deposit the balance amount aggregating to 25% of the bid amount of the sale price immediately i.e. on the same day or not later than the next working day on receipt of the sale confirmation letter and the remaining bid amount within 15 days of the confirmation of sale of the property or such extended period as may be agreed upon in writing between the purchaser and the Bank. Payment shall be made only in the form of Bankers Cheque Demand Draft favoring "Bandhan Bank Limited".
- 4. In case the successful bidder either fails to deposit 25% of bid amount immediately on the acceptance of the sale confirmation letter or fails to pay the remaining amount within 15 days or any such extended period, the 10% EMD amount of the offer price and / or the balance fails to pay the remaining amount within 15 days or any such extended period, the 10% EMD amount of the offer price and / or the balance fails to pay the remaining amount within 15 days or any such extended period, the 10% EMD amount of the offer price and / or the balance fails to pay the remaining amount within 15 days or any such extended period, the 10% EMD amount of the offer price and / or the balance fails to pay the remaining amount within 15 days or any such extended period, the 10% EMD amount of the offer price and / or the balance fails are the fails of the fails are the fails of the fails are the fails of the fails are amount aggregating to 25% of the bid amount made by the bidder, if any, shall be forfeited by the Authorized Officer without any further correspondence and the property shall be sold again in accordance with provisions of the SARFAESI Act and the Rules made there under.
- The sale will be on "AS IS WHERE IS BASIS" "AS IS WHAT IS BASIS" and "NO RECOURSE BASIS". The details of the encumbrances as regards electricity dues, municipality taxes and / or society dues etc., if any, shall be made available on the date of inspection. Other than the above, Authorized Officer is not aware of any other encumbrances other than as stated above or otherwise over the said property. All the expenses, charges, fees and other incidental expenses including the encumbrances as stated above in connection with the sale and issuance of Sale Certificate including applicable stamp duty, registration charges, etc. shall be borne and paid by the Purchaser.
- Where the amount of dues of GRUH (Now "the Bandhan Bank" as stated in aforesaid paragraph) together with all costs, charges and expenses incurred by it is tendered by the borrowers / mortgagor to GRUH (Now "the Bandhan Bank" as stated in aforesaid paragraph) at any time before the date of publication of notice inviting tender from public or before the date of execution of the sale certificate, no further step shall be taken for the sale of the secured asset to the bidder.
- The Authorized Officer has the absolute right to accept or reject any bid without assigning any reason whatsoever, at any point of time.
- 8. The sale will be subject to confirmation by Bandhan Bank Limited.

Date: 15/02/2023 Bandhan Bank Limited **Authorised Officer**

Vadodara



वापी-वस्याऽ-संध्यादेशकंड्य

બુધવાર, તા.૧૫-૦૨-૨૦૨૩ | વલસાડ : ૨७, બી.ડી.સી.એ. શોપીંગ સેન્ટર, નગરપાલિકા પાર્કિંગ પ્લોટ સામે, મમતા હેલ્થ સેન્ટરની ઉપર, લીન્ક રોડ. ૬૫૧૨૩૦, ૨૪૫૧૨૩ વાપીઃ ૩-૪, ગોલ્ડન પોઈન્ટ, જલારામ ખમણની બાજમાં, સેલવાસ રોડ. ૨૪૩૨૬૬૨

વલસાડ નગરપાલિકા तंत्रना वोवंवोव वहीवटनो वधु એક તમૂનો ઉજાગર થયો

વલસાડમાં 271 કામદારો છતાં સફાઈ પાછળ બે મહિનામાં રૂપિયા 14.21 લાખ ખર્ચી નંખાયા

ગુરુવારે યોજાનાર સામાન્ય સભાના એજન્ડા પર એજન્સીને ચુકવણું કરવા માટેનું કામ મુકાતા મામલો સામે આવ્યો

વલસાડ નગરપાલિકા તંત્રનું વધુ એક ધુપ્પલ ઉજાગર થયું છે. પાલિકા પાસે પોતાના ૧૭૯ જેટલા સફાઇ કામદારો જુના વલસાડ શહેરમાં અને ૯૨ જેટલા મજૂરો મોગરાવાડી-અબ્રામામાં છે. જેઓને પાલિકાતંત્ર રોજના ૩૫૯.૩૦ રૂ. ચૂકવે છે તેમ છતાં નવેમ્બર-ડિસેમ્બર-૨૦૨૨ એમ બે માસ દરમિયાન વાપીની ખાનગી એજન્સી મારફતે શહેરમાં સફાઇ, ઝાડીઝાંખરા કટિંગ, બ્રસિંગ સફાઇ અને ગટર સફાઇની કામગીરી પાછળ ૧૪.૨૧ લાખ રૂપિયાનું આંધણ કરી નંખાયું છે. પાલિકાની આગામી તા. ૧૬મીએ યોજાનાર સામાન્ય સભાના એજન્ડા ઉપર આ કામ મુકાતા મામલો સામે આવ્યો છે. મહત્ત્વની બાબત એ છે કે, આ એ જ એજન્સી છે જેની સામે ડ્રેનેજ વિભાગના ચેમ્બરોની સફાઇ કરી નહીં હોવા છતાં પેપર ઉપર કામગીરી

માનીતાઓને નિયમોની ઉપરવટજઈ કામ સોંપાતા વિવાદ વકર્યો

ખાનગી એજન્સી મારફતે નગરમાં સફાઇ કરાવવાની કામગીરીના નામે કૌભાંડ આચરવામાં આવ્યું હોવાની ચર્ચામાં તથ્ય એટલા માટે જણાય છે કે, ૧૪.૨૧ લાખ રૂ. જેટલી મોટી રકમની કામગીરી હોવા છતાં તે અંગે જે તે સમયે કારોબારી સમિતિમાં કોઇ ઠરાવ થયો નહીં, ટેન્ડરિંગ થયું નહીં, વર્કઓર્ડર અપાયો નહતો. મળતી માહિતી મુજબ વર્ષ-૨૦૧૮માં સુરતની એજન્સી પાસે કામગીરી કરાવવા માટે થયેલા ઠરાવના આધારે જ વાપીની એજન્સીને બારોબાર કામ આપી દેવાયું હતું. જે બાદ છેક તા.૧૧-૦૧-૨૦૨૩ની મળેલી કારોબારી સમિતિની બેઠકમાં ઉપરોક્ત સફાઇની કામગીરીનો થયેલો ખર્ચ રૂં. ૧૪.૨૧ લાખ મંજૂર કરવા જનરલ બોર્ડને ભલામણ કરવા અંગે ઠરાવ કરાયો હોવાનું સામે આવ્યું છે.

બતાવીને રૂ. ૧૨ લાખથી વધના બોગસ પડે છે. જે માટે પાલિકાની સ્વભંડોળની બિલો મુક્યા હોવાની ફરિયાદો ઊઠી હતી. વલસાડ નગરપાલિકાની માલિકીના

જેટિંગ મશીનના ટાયરો જના થઇ ગયાં હોવાથી નવા ટાયરો નાંખવા પડે તેમ હતા. પરંતુ તે માટે ૫૦,૦૦૦ રૂ. નહીં હોવાથી જેટિંગ મશીન ૮ મહિના સુધી બંધ હાલતમાં પડી રહ્યું હતું. બાંધકામ વિભાગના તાબાનું જેસીબી મશીન દોઢ વર્ષથી બંધ છે, સેનેટરી વિભાગના તમામ ટ્રેક્ટરોમાં બેટરી સહિતના જરૂરી સાધનોના અભાવે ધક્કો મારીને ચલાવવા

તિજોરી ખાલીખમ્મ હોવાનં કારણ આગળ ધરવામાં આવે છે. બીજી તરફ, પાલિકાના સેનેટરી વિભાગ પાસે ૨૭૧ જેટલા રોજમદાર સફાઇ કામદારો હોવા છતાં વાપીની ખાનગી એજન્સી મારફતે તહેવારોમાં સફાઇ કરાવવાના નામે લાખો રૂપિયાનો ધુમાડો કરાઇ રહ્યો હોવાની ચોંકાવનારી હકીકત સામે આવી છે.

વલસાડ પાલિકાની બજેટ મંજૂર કરવા અંગેની આગામી તા. ૧૬-૦૨-૨૩ના રોજ યોજાનાર સામાન્ય સભાના

એજન્ડામાં કામ નં. ૩૦માં, આરોગ્ય શાખા મારફત દિવાળીના ધાર્મિક તહેવાર નિમિત્તે વલસાડ શહેર વિસ્તારમાં સકાઇ. ઝાડીઝાંખરા કટિંગ, બ્રસિંગ સફાઇ અને ગટર સફાઇ જેવી કામગીરી બે માસ માટે કામદારો તેમજ ટ્રેક્ટર સહિત ભાડેથી એજન્સી મારફતે મંગાવી કરાવી હતી. જે અંગે એજન્સી સપ્તશંગી લેબર સપ્લાયનં આવેલુ બિલ રૂ. ૧૪,૨૧,૦૦૦ પૂરા મંજૂર કરવા અંગે જરૂરી નિર્ણય થવા બાબત એવી નોંધ કરાઇ હતી. જે અંગે સંદેશે તપાસ કરતા ચોંકાવનારી માહિતી

સામે આવી છે. વલસાડ પાલિકા પાસે જુના વલસાડમાં ૧૭૯ અને મોગરાવાડી-અબ્રામામાં ૯૨ મળી પોતાના ૨૭૧ જેટલા રોજમદાર સફાઇ કામદારો કાર્યરત છે. આટલા બધા કામદારો હોવા છતાં વાપીની ખાનગી એજન્સી મારફતે તા. ૧૯-૧૦-૨૨થી બે માસ માટે કામગીરી કરાવી હોવાનું બહાર આવ્યું હતુ. જેમાં ખાનગી એજન્સી દ્વારા દિવસમાં સરેરાશ ૨૩થી ૨૫ અને રાત્રે સરેરાશ ૧૦થી ૧૫ જેટલા કામદારો સપ્લાય કરવામાં આવ્યા હોવાનું એજન્સી દ્વારા રજૂ થયેલા બિલ ઉપરથી જણાયું છે. આમ છતાં વલસાડ શહેરમાં ઓક્ટોબર-નવેમ્બર-ડિસેમ્બર-૨૨ માસ દરમિયાન ઠેર-ઠેર ગંદકી જણાતી હતી. જે અંગે સંદેશએ દિવાળી પર્વે વેપારીઓની ફરિયાદોને આધારે અહેવાલો પ્રસિદ્ધ કર્યા હતા. ત્યારે આ કામમાં કૌભાંડ હોવાની શક્યતા નકારી શકાતી નથી.

ખેડતોને બાંધકામ અને ઝાડ ઉગાડવા પર પ્રતિબંધ લાદી દેવાયો પારડીમાં પાવરગ્રીડ કંપનીની લાઈનથી ધરતીપુત્રોને મોટું નુકસાન થવાનો ભય

પારડીમાંથી પસાર થનાર પાવરગ્રીડ કંપનીની હાઈટેન્શન લાઈનથી ખેડૂતોને નુકસાન થઈ રહ્યાની બુમ ઊઠી છે. યોગ્ય વળતર ન મળવાની આશંકા સાથે ખેડૂતોમાં આક્રોશ ફેલાઈ રહ્યો છે.

પાવરગ્રીડ કંપની હાઈટેન્શનની લાઈન નવસારીથી દમણ લઈ જવા માટે પારડી તાલુકાના ખેડતોની જમીન સંપાદન કરવા તજવીજ થઈ રહી છે. પરંતુ તે પછી યોગ્ય વળતર ન મળવાની આશંકા ઊભી થઈ છે. જેના કારણે ખેડૂતોમાં નારાજગી ફેલાઈ રહી છે. આ સાથે હાલ જમીનમાં પાવરગ્રીડ કંપની દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો છે. જેને કારણે ખેડતોને જમીનમાં બાંધકામ કે વૃક્ષ ઉગાડવા પર પ્રતિબંધ રાખવામાં

શાકભાજી, અનાજ કે અન્ય પાકોમાં વિક્ષેપ પડશે તેવું જણવાયું છે.

પારડી તાલકાના તીંઘરા ગામના ખેડત એવા કિરણભાઈ દેસાઈએ તેમની વડીલોપાર્જિત મિલકત આવેલી છે. તેમાં ચીકુના ઝાડ ઉગાડવામાં આવ્યા છે. આ જ ચીકુનો પાક કરી તેઓ આર્થિક ઉપાર્જન મેળવી જીવર્ન નિર્વાહ કરે છે. તેમણે જણાવ્યું હતુ કે, પારડીના લોકોએ બુલેટ ટ્રેન, એક્સપ્રેસ આવ્યો છે. આવા સંજોગોમાં ફળ, હાઈ-વેમાં નુકસાન વેઠ્યું છે. તે પછી

હવે નવા પ્રોજેક્ટોથી ખેડૂતો પાયમાલ થઈ જશે. વધુમાં તેમની વાડીમાંથી સરકારી પાણીની નહેર પણ પસાર થઈ રહી હોવાથી ભવિષ્યમાં શોર્ટ સર્કિટના કારણે મોટી દુર્ઘટનાની શંકા તેમણે વ્યક્ત કરી હતી.

આમ નવસારીથી દમણ સધી જનાર પાવરગીડ હાઈટેન્શન (૪૦૦ કેબી)ની લાઈનથી પારડી તાલુકાના ખેડૂતોને થનાર નુકસાન બદલ યોગ્ય વળતરની આશા ખેડૂતો રાખી રહ્યા છે.

જમીનની સફાઈ દરમિયાન તીવ્ર દુર્ગંધ આવતા તપાસ ડુંગરીની અવાવરું જગ્યામાંથી આધેડની કોહવાઈ ગયેલી લાશ મળતા ચકચાર

વલસાડના ડુંગરી વિસ્તારની એક અવાવરું અને પડતર જમીનની સાફસફાઈ કરતી વેળા એક અજાણ્યા વ્યક્તિની લાશ ડીકંપોઝ થઈ ગયેલી હાલતમાં મળી આવી હતી. ઘટનાની જાણ ડુંગરી પોલીસને કરાતા, પોલીસે હાલે અકસ્માત મોત મુજબ ગુનો નોંધી ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.

વલસાડના ડુંગરી સ્થિત છાપરી ડુંગરી ફળિયામાં નવીનાબેન નાનુભાઈ પટેલની માલિકીની જમીન આવેલી છે. જે જમીન પડતર હોય. જમીનમાં ઝાડીઝાંખરા ઊગી નીકળ્યા છે. પડતર જમીનમાં ઉગી નીકળેલા

કરવા માટે, બુલડોઝરની મદદથી ગતરોજ સાફસફાઈ કરવામાં આવી રહી હતી. આ દરમિયાન પડતર જમીનના ઝાડીઝાંખર પાસે એક અજાણ્યા પુરુષની અત્યંત કોહવાઈ ગયેલી અને ક્ષતવિક્ષત હાલતમાં, તીવ્ર દુર્ગંધ મારતી લાશ મળી આવી હતી. અવાવરું અને પડતર જમીનમાં કોઈક અજાણ્યા વ્યક્તિની ડીકંપોઝ થયેલી લાશ મળી આવવા બાબતની

જાણ, ડુંગરી પોલીસને કરાઈ હતી. ઘટનાની ગંભીરતા પારખીને ડુંગરી પોલીસ મથકના ઇન્ચાર્જ પી. એસ.આઈ. જે.જે.ડાભી સહિતની

અને નડતરરૂપ ઝાડીઝાંખરા દૂર ડુંગરી પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે એફ.એસ. એલ. વિભાગની મદદ પણ લીધી હતી. અજાણ્યા ઈસમની અત્યંત કોહવાઈ ગયેલી લાશનો પોલીસે કબજો લઇ લાશનું ફોરેન્સિક પી. એમ. કરાવવા માટેની તજવીજ હાથ ધરી હતી. મૃતક અજાણ્યા વ્યક્તિની લાશ પરથી પોપટી કલરનું લાઇનિંગ વાળું શર્ટ, કાળા કલરની જીન્સ પેન્ટ મળી હતી. મૃતક અજાણ્યા વ્યક્તિની ઓળખ નહિં થતા, ડુંગરી પોલીસે અજાણ્યા મૃતકના વાલીવારસોની શોધખોળ કરવાની તજવીજ હાથ ધરી છે.

વિદ્યાર્થિનીનો ફોન ચોરાતા ઈ-ગુજકોપથી ફરિયાદ નોંધાવાઈ

પારડી પરિયાના બરવાડી ફળિયા ખાતે રહેતી અને પારડી કોલેજમાં અભ્યાસ કરતી તન્વીબેન ગણેશભાઈ ધો. પટેલ (ઉ.વ. ૧૯) પોતાના ઘરેથી બસમાં બેસી પારડી ચાર રસ્તા પર ઉતરી કોલેજ સુધી ચાલતી ચાલતી ગઈ હતી. કોલેજમાં લેકચર ચાલુ થઈ ગયું હોવાથી તે ફરી બહાર આવી હતી. આ સમયે તેણીએ બેગમાં મુકેલા ફોનમાં ટાઈમ જોઈ ફોન ફરી બેગમાં મૂકી દીધો હતો. ત્યારબાદ પોતાની ફ્રેન્ડ સાથે ત્રીજા લેકચરમાં એટેન્ડન્ટ કરવા તેણી ગઈ હતી. જે પૂર્ણ કરી ચાલતાં ચાલતાં પારડી પહોંચી બસમાં બેસી ઘરે જવા નીકળી હતી. દરમિયાન બેગમાંથી પાસ કાઢવા જતા તેને મોબાઈલ જોવા ન મળતા તપાસ કરી હતી. જો કે, ફોન ન મળતા તન્વીબેને પારડી પોલીસ મથકે ઈ-ગુજકોપમાં મોબાઈલ ચોરીની કરિયાદ નોંધાવી હતી.

મેળામાં આશરે ૧ લાખથી વધુ શિવભક્તો ઊમટે તેવી શક્ચતા બાલચોંઢી મહાદેવ મંદિરે મહાશિવરાત્રી પર્વનેપગલેત્રિદિવસીયમેળાનું આયોજન

કપરાડાના બાલચોંઢી સ્થિત ૧૦૦ વર્ષ જૂના શ્રી ભુવનેશ્વર મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રી પર્વને અનુલક્ષીને વર્ષ ૧૯૬૨થી ભરાતા ત્રિદિવસીય મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. મેળામાં આશરે ૧ લાખથી વધુ શિવભક્તો ઊમટે તેવી શક્યતા દર્શાવાઈ

કપરાડાના બાલચોંઢી સ્થિત અને કોલક નદીના કિનારે આવેલું અને આશરે ૧૦૦ વર્ષ જૂનુ શ્રી ભુવનેશ્વર મહાદેવ મંદિર આ વિસ્તારના રહીશો માટે આસ્થાનુ પ્રતીક છે. મંદિર પાસે આવેલા વાંસના જંગલ પાસે શ્રી હનુમાનજીની સ્વયંભ નીકળેલી પ્રતિમાની મંદિરના પ્રાંગણમાં વિધિવત સ્થાપના કરવામાં મેળાનું આયોજન કરવામાં આવે છે. આ ઉઠાવી રહ્યા છે.



આવી છે. મંદિર પાસે આવેલ ગંગાજી વર્ષે ત્રિદિવસીય મેળાનું આયોજન કંડમાં અવિરત પાણી નીકળે છે. શિવાલયમાં આવતા શિવભક્તો ગંગાજી કંડમાં સ્નાન કર્યા બાદ દર્શન કરી ધન્યતા અનુભવે છે. વર્ષ ૧૯૬૨માં શ્રી ભુવનેશ્વર મહાદેવ મંદિરનું રિનોવેશન કરવામાં આવ્યું હતું . જે બાદ મંદિરના પાંગણમાં મહાશિવરાત્રી પર્વ નિમિત્તે ટ્રસ્ટી મંડળના સભ્યો ભારે જહેમત

કરવામાં આવ્યું છે. મેળામાં આશરે ૧ લાખ શિવભક્તો ઊમટી પડે તેવી શક્ચતા દર્શાવાઈ રહી છે. આયોજનને સફળ બનાવવા ગામના માજી સરપંચ અને ટ્રસ્ટી હરેશભાઇ પટેલના નેજા હેઠળ ગામના રહીશો ઉપરાંત મંદિરના

સિનિયર સિટીઝન કાઉન્સિલ વાપીના સભ્યોને આરોગ્યલક્ષી જાણકારી અપાઈ

વાપીની સિનિયર સિટીઝન કાઉન્સિલના સભ્યોને તબીબ દ્વારા સેમિનાર યોજી આરોગ્યલક્ષી માહિતી આપવામાં આવી હતી.

સિસિકાના પ્રમુખ દિનેશભાઈ દેસાઈ દ્વારા શેલ્બી હોસ્પિટલને સિસિકાના સભ્યોને આરોગ્યલક્ષી જાણકારી આપવા અપીલ કરી હતી તે સંદર્ભે રવિવારે બે તબીબ ડૉ. પરાગ તલેકર (ઓર્થોપેડિક) તથા ડૉ. રાહુલ જાધવ (જનરલ એન્ડ લેપ્રોસ્કોપીક સર્જન)એ હાજર રહી સુંદર સમજ આપી હતી. ઘૂંટણ અંગેના રોગો તથા ઘૂંટણ કેમ બદલવી પડે તથા સાવચેતી શું રાખવી ? વગેરે ઉપરાંત એસિડિટી તથા કિડની અને તેને લગતા રોગો જેવા કે યુનિર ઈન્ફેક્શન વગેરેની સમજણ આપી હતી.

BIS 916 હોલમાર્ક દાગીનાનો આજનો સોનાનો ભાવ

ડુંગરામાં તાજી જન્મેલી બાળકીનો મૃતદેહ કચરાના ડ્રમમાંથી મળ્યો

એ વિંગ બીલ્ડીંગની પાર્કિંગવાળી જગ્યામાં બે દિવસ પહેલા જન્મેલી બાળકી મૃત કચરા પેટીના પ્લાસ્ટીકના ડ્રમમાંથી તાજી હાલતમાં છે. આ બાતમીને આધારે સ્થળ જન્મેલી બાળકીનો મૃતદેહ મળી આવતા પર પહોંચેલી ડુંગરા પોલીસે તપાસ કરતા નિષ્ઠુર માતા પ્રત્યે ફિટકારની લાગણી કોઈ માતાએ પોતાનુ પાપ છુપાવવાના વરસી રહી છે. વાપી નગરપાલિકા ઈરાદે આ કૃત્ય કર્યાનું જણાયું હતું. પોલીસે કાઉન્સીલરે ડુંગરા પોલીસ મથકે ટેલીફોનિક મૃત બાળકીની ડીકમ્પોસ જેવા દેહનો કબજો જાણ કરી જણાવ્યુ હતું કે, ડુંગરા હરિયાપાર્ક લઈ મરનાર બાળકીના વારીવારસની નજીક દિલીપ નગર ખાતે આવેલી પીસ તપાસ આદરી છે.

વાપી ડુંગરા દિલીપનગર પીસ એવન્યુ પાર્કિંગમાં રાખેલા કચરાના ડ્રમમાં આશરે

🚬 🚉 📲 વાપી, વલસાડ, નવસારી સંઘપ્રદેશ આવૃત્તિ માટે X e (8박 회사원회). 등등대 및I. 600/-દુઃખદ અવસાન કાહાંજલિ

वापी : विति क्षेत्रम : कोल : २४३२६६२, ८८२५४५९०५९ • वसमाड ભાગ્યાવીએક : કોળ : ૨૪૫૧૨૩, ૯૮૭૯૧૬૬૨૫૯ • નવસારી : સંદેશ કાર્યાલય રપરદૃદ્ધ, • અનુરાદ્યા એફ્સ : ૭૦૪૩૭૭૯૭૯૦ • હેલુલ પંક્યા : ૯૮૭૯૨ ૮૨૩૨૯ બીલીમોરા : શ્રી સાંઇકુપા એક : ૯૪૨૭૭૦૬૬૦૮ • ઉમરગામ : લબ્બા એક ૯૮૨૫૧૧૧૦૩૮ • सतीगाम : यशस्यी એન્ટરપ્રાઈઝ : ૯૯૭૮૯૫૯૬૫૩ • पांसहा : સમર્થ એક : ၄૦૮૬૮૫૬૧૧૧ • श्रीपाबी : ધીદોપભાઈ એમ. પટેલ : ૯૯૨૫૦ ૮૫૬૦૦ ધરમપુર : શ્રી પટેલ ન્યુઝ એજન્સી : ૦૨૬૩૩–૨૪૨૨૪૪ • सुरत ओड़िस : ०२६९-४०८६०३४

નોંધ : ઉપરોક્ત ભાવમાં GST અલગથી લાગશે



યુવતીના ઘરે પહોંચી યુવકના પરિવારે તોફાન મચાવ્યું હતું મહિલાના અપહરણ કેસમાં અન્ય ત્રણ આરોપીના અલાયદા જામીન નામંજર

પરિણીત પુત્રના અન્ય યુવતી સાથે સંબંધથી પરિવાર નારાજ હતો

અને શેસન્સ કોર્ટમાં અલાયદી રેગ્યુલર જામીન અરજી રજૂ કરી હતી. જે જામીન અરજી કોર્ટે નામંજુર કરતો ચુકાદો આપ્યો છે.

નાસિક જિલ્લાના સુરગાણા તાલુકાના રગતવેરી ગામના મગનભાઇની પત્ની કામિનીબેન પારીલ ફળિયામાં રહેતા ભીનું જીવલ રાઉતનો પુત્ર રાજેશ રાઉત પરિણીત અને બે સંતાનોનો પિતા હોવા છતાં ધરમપુરના બિલ્ધા ગામે રહેતા મગનભાઇ ચૌધરી (નામ બદલ્યુ છે)ની પુત્રી સાથે છેલ્લા એક વર્ગથી પ્રેમસંબંધ ધરાવતો હતો અને છેલ્લા આઠેક દિવસથી પ્રેમિકાના ઘરે આવીને

ભરાયેલા રાજેશના પિતા ભીનું આપનાર રાજેશની માતા ધરમપુરના બિલ્ધા ગામની રાઉત, ભાઇ ઇશ્વર રાઉત, જુનલીબેન ભીનું રાઉત, જયંતિ મહિલાનું અપહરણ કરવાના સંબંધીઓ જ્યોતિગ બનું રાઉત નવસુ રાઉત અને જયવંત રામે ગુનામાં સંડોવાયેલા અન્ય ત્રણ અને યશવંત નવસુ રાઉત ગત તા. ચવધરી (તમામ રહે. રગતવેરી, આરોપીઓએ જામીનમુક્ત થવા ૨૪-૦૧-૨૩ના રોજ રાત્રીના જી. નાસિક) મળી કુલ ૦૭ ધરમપુરની એડિશનલ ડીસ્ટ્રીકટ સમયે ઇકો કાર નં. જીજે.૨૧. આરોપીઓની ધરપકડ કરી હતી. યુવતીના પિતા મગનભાઇ ચૌધરીને લાકડાંના સપાટા મારીને (નામ બદલ્યુ છે)નું બળજબરીથી ઇકો કારમાં અપહરણ કરી ગયાં

મથકમાં નોંધાઇ હતી. સુરગાણા ખાતે જઇને અપહૃત કામિનીબેનનો કબ્જો લઇ, ગુનો રાઉત, જ્યોતિગ રાઉત યશવંત જામીન અરજી નામંજુર કરતો રહેતો હતો. જેની જાણ થતાં રોષે રાઉત ઉપરાંત આ ગુનામાં સાથ ચુકાદો આપ્યો છે.

સીસી.૮૭૪૨માં બિલ્ધા ગામે મહિલાનું અપહરણ કરવાના પહોંચ્યા હતા અને ત્યાં હાજર ગુનામાં સંડોવાયેલા યશવંત નાવસુભાઇ રાઉતા, જ્યંતીનવસુરાઉત અને જસવંત ાંભીર ઇજા પહોંચાડ્યા બાદ રામેભાઈચવધરીએ જામીનમુક્ત થવા ધરમપુરની એડિશનલ ડીસ્ટ્રીકટ અને શેસન્સ કોર્ટમાં અલાયદી રેગ્યુલર જામીન અરજી હોવાની ફરિયાદ ધરમપુર પોલીસ રજુ કરી હતી. જે બાબતે હાથ ધરાયેલી સુનાવણીમાં સરકાર પક્ષે ધરમપુર પોલીસની ટીમે એ.પી.પી રાજેશભાઈ આર. ગાંધીએ દલીલો કરી હતી . જે દલીલાને ગ્રાહ્ય રાખી કોર્ટના આચરનાર ભીનું રાઉત, ઇશ્વર વિદ્વાન જજ અશોક શર્માએ

નવસારીનું ન્યૂનતમ તાપમાન ૧૫.૪ ડિગ્રી સે.

વાપી, તા. વાપી, જી. વલસાડ

નવસારી : નવસારીમાં આજરોજ મંગળવારે મહત્તમ તાપમાન ૩૫.૨ ડિગ્રી સે. રહ્યું હતું. નવસારી કૃષિ યુનિવર્સિટીના હવામાન ખાતાની માહિતી મુજબ મહત્તમ તાપમાન ૩૫.૨ ડિગ્રી સે. ત્યારે ન્યૂનતમ તાપમાન ૧૫.૪ ડિગ્રી સે. અને ભેજનું પ્રમાણ સવારે પ૩ ટકા અને સાંજે ૨૦ ટકા નોંધાયું હતું.

જાહેર નોટિસ આથી જાહેર જનતાને જણાવવાનું કે, વાપી તાલુકાના મોજે રાતા ગામે નીચેના સર્વે નંબર વાળી ખેતીની જમીન બાબતે શ્રી ચોગેશભાઈ મણીચાભાઈ પટેલ વિગેરેનાઓએ કોકીલાબેન મગનલાલ શાહ વિગેરેનાઓ વિરુદ્ધ મે. વાપીના પ્રિન્સીપલ સીની.સિવિલ જડજ સાહેબની કોર્ટમાં રે.દિ.મું.નં. ૦૬/૨૩ થી દાવો દાખલ કરેલ છે અને જે દાવો હાલે ચાલુ છે. જેથી સદર મિલકત અંગે મેટર સબજયુડાઈઝ હોય કોઈપણ વ્યક્તિએ કોકીલાબેન મગનલાલ શાહ વિગેરેનાઓ પાસેથી નીચે જણાવેલ જમીન ખરીદ કરવી નહી જેની જાહેર

भिसङतनुं पर्शन હે. આરે. आडार 0-69-96 8.50 59 53 0-69-03 8.50 8.44 સરનામું : ૧૦૪, સુપર માર્કેટ, તા પી.ડી. પટેલ वापी टाउन पोक्षीस स्टेशननी साभे તે યોગેશભાઈ મણીયાભાઈ પટેલના એડવોકેટ

બાલદામાં કોલેજના બાંધકામ માટે આવેલા મજૂરનું હાર્ટએટેકથી મોત

વાપી : પારડી નજીકના બાલદા ગામે નિર્માણાધિન સરકારી સાયન્સ કોલેજના મકાનમાં મજૂરી કામે આવેલા યુવાનનું

બાથરૂમમાં પડી જવાથી મોત નિપજ્યું હતું. બાલદા ગામે સરકારી સાયન્સ કોલેજના મકાનનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. ત્યા કન્ટ્રકશનના કામે મજુરી કામે આવી ત્યાં જ રહેતા મૂળ બિહારના વતની એવા મોહમદ સમજાન સહવાસ રીહાન (ઉ.વ. ૩૨) મંગળવારે સવારે કુદરતી હાજતે જવા મકાનની બાજુમાં બનાવેલા બાથરૂમમાં ગયો હતો. જે ત્યા અચાનક પડી જઈ બહેશો થઈ ગયો હતો. આથી તેને તેના સાથી બેહોશ હાલતમાં કોન્ટ્રાકટર બીનયકુમાર પંચલાલ શાહની રૂમ ઉપર લઈ ગયા હતાં. જયાં તરત રાહુલ બટુકભાઈની ગાડીમાં તેને સુવડાવી પારડી હોસ્પિટલમાં લઈ જવાયો હતો. પરંતુ ત્યાં ફરજ પરના તબીબે મોહમદ સમજાનને એટેક આવવાથી મૃત્યુ થયુ હોવાનુ નિદાન કર્યુ હતું.

Samarpan Gnyan School CBSE Affiliation No. 430282
Plot No: 408, Rata, Near Rata Gram Panchayat, Salvav-Rata Road, Via — Chhiri, Vapi (East), Gujarat- 396191
If you think you can change lives with the right mix of chalk and challenges, You're invited!

Academic Positions Open Year 2023-24 Walk-In Interview on 19/02/2023 (SUNDAY) from 10:00 am to 4:00 pm Pre-Primary Teachers : Graduates with good communication skill,
 E.C.C.E / NTT/Montessori Trained with 1 (pr) 2 years of experience in teaching. For All Subjects: ENGLISH, HINDI, MATHEMATICS, PHYSICS, CHEMISTRY, BIOLOGY, ACCOUNTANCY, ECONOMICS, BUSINESS STUDIES, SOCIAL SCIENCE, COMPUTER SCIENCE, PHYSICAL EDUCATION Qualification: B.A./M.A./B.Com./ M.P.Ed (M.Com./B.Sc./M.Sc./BCA/MCA/M.Sc. (IT) with B.Ed. Co-Curricular Activity Teacher: Skating's, Karate, Art & Craft, Dance, Music, Counsellor, Special Educator, Nurse. Qualification: Post graduates in their respective field. Parent Relationship Executive, Marketing Executive, Admin, Accountant Qualification: Graduates and with a Computer knowledge. Freshers can also apply

Interested candidates can share their resume / CV with recent passport size photograph to

principal.samarpan@gmail.com Contact No.: 9316755972 / 7984913222 • Website :- www.sgsvapi.org

SHREE AJIT PULP AND PAPER LIMITED Regd. Office: Survey No. 239, Near Morai Railway Crossing, Village Salva

E-mail: investors@shreeajit.com, Website: www.shreeajit.com, Tel.no. 0260-6635700, Fax no. 0260-2437090. CIN: L21010G11995PLC025135 Extract of Consolidated Unaudited Financial Results for the Quarter and Nine months ended 31st December, 2022.

| Sr. No. | Particulars | 3 months 9 months ended ended (31/12/2022) (12/12/2022) | | Corresponding 3 months ended (31/12/2021) | |
|---------|--|---|-----------|--|--|
| | | Unaudited | Unaudited | Unaudited | |
| 1 | Total Income from operations | 8,662.09 | 29,612.77 | 10,678.53 | |
| 2 | Profit before Tax | 1,722.27 | 2,410.11 | 748.12 | |
| 3 | Profit for the period | 1,541.42 | 2,028.36 | 535.35 | |
| 4 | Total Comprehensive Income for the period | 1,543.16 | 2,033.03 | 534.41 | |
| 5 | Equity Share Capital | 535,67 | 535.67 | 535.67 | |
| 6 | Other Equity | | | | |
| 7 | Earnings per share Basic and Diluted (₹-not annualized) (Face value of ₹ 10 per share) | 28.78 | 37,87 | 9.99 | |

1. The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with the Stock Exchange unde Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Standalone and Consolidated Quarterly Financial Results are available on the Company's website "www.shreeajit.com" and Bombay Stock Exchange's website "www.bseindia.com

| | Particulars | 3 months ended (31/12/2022) | 9 months ended (12/12/2022) | Corresponding 3 months ended (31/12/2021) | |
|-------|---|--|-----------------------------------|--|--|
| | | Unaudited | Unaudited | Unaudited | |
| | Total Income from operations | 8,662.09 | 29,612.77 | 10,678.53 | |
| | Profit before Tax | 654.64 | 1,363.10 | 738.13 | |
| | Profit for the period | 473.99 | 981.93 | 525.55 | |
| | Total Comprehensive Income for the period | 475.73 | 986.60 | 524.61 | |
| :e :- | Vapi | For and on Beha Sd/- Gautam D Shah Chairman and M | N 01 B0219.000 | | |

SANDESH SURAT WEDNESDAY, 15•02•2023

સંદેશના અહેવાલ બાદ અધિક કલેક્ટરે રેલવેના એરિયા મેનેજરને બાંધકામ દૂર કરવા તાકીદ કરી , હાઇવે નજીકની દીવાલ દૂર કરાશે

80 મીટરની જગ્યામાં એકદમ રોડ પર બાંધી દીધેલી દીવાલ દૂર કરવા સંમતિ આપ્યા બાદ ફેરવી તોળ્યું હતું

વલસાડ શહેરમાંથી પસાર થતા અને સ્ટેટ હાઇ વે તરીકે ગણાતા ધરમપુર રોડ પર રેલવે વિભાગ દ્વારા તેમની માલિકીની જમીન છે તેવો હક્કદાવો રજૂ કરીને સ્ટેટ હાઇવેને અડોઅડ બનાવી દેવાયેલી ૨૮૦ મીટર લંબાઇની દીવાલ પૈકી સાવ રોડ ઉપર બાંધી દીધેલા ૮૦ મીટરના બાંધકામને દૂર કરવા બાંયધરી આપી દીધા બાદ તેમની વાતથી ફરી જવા અંગે સંદેશે ગત તા. ૦૮મી ફેબ્રુઆરીના રોજ પ્રસિદ્ધ કરેલા અહેવાલનો પડઘો અંતે પડ્યો છે. રેલવે વિભાગ દ્વારા એ ૮૦ મીટરનું બાંધકામ દૂર કરવાની કામગીરી આજથી શરૂ કરી દેવાઇ છે. હવે રેલવે સ્ટેશન પર જવા માટેના બંધ કરી દેવાયેલા રસ્તા ખોલવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રેલવે તંત્ર પર દબાણ લાવે તે ઇચ્છનીય છે.

વલસાડના ધરમપુર રોડ (સ્ટેટ હાઇવે) ઉપર વલસાડથી ધરમપુર તરફના લેનને અડોઅડ રેલવે વિભાગ દ્વારા દીવાલ બનાવવાની કામગીરી કરવાને કારણે ટાફિકથી ધમધમતો આ સ્ટેટ હાઇવે ભવિષ્યમાં ક્યારેય પહોળો થઇ શકશે નહી તેવા સંજોગો ઉભા થયા છે. સાથે જ રાહદારીઓ માટે રસ્તો કાયમી ધોરણે બંધ થઇ જશે અને અહીં ભયંકર ટ્રાફિક સમસ્યા સર્જાશે તેને ધ્યાને રાખીને સંદેશએ રેલવે દ્વારા થતાં બાંધકામને દૂર કરવા માટે ઉપાડવામાં આવેલ ઝુંબેશ અંતે રંગ લાવી છે.

સંદેશના અહેવાલોને આધારે વલસાડના ધારાસભ્ય ભરતભાઇ પટેલે તા. ૨૧-૦૧-૨૩ના રોજ યોજાયેલી જિલ્લા સંકલનની બેઠકમાં ઉઠાવેલા



પ્રશ્નના જવાબમાં, વલસાડ મા. અને મ. વિભાગના કા.ઇ. નિલેશભાઇ પટેલે, ૨૮૦ મીટરની દીવાલ પૈકી ૮૦ મીટરની દીવાલ તો એકદમ રોડ પર બાંધી દીધી હોવા અંગે તેમણે રેલવેના એરિયા મેનેજરને વાત કરતા, તેમણે એ ૮૦ મીટરની દીવાલ હટાવવા મૌખિક સંમતિ આપી હોવાની માહિતી આપી હતી. જેના ૧૬ દિવસ પછી પણ રેલવે વિભાગે બાંધકામ દૂર કર્યુ નહોતું. જેને લઇને સંદેશે ગત તા. ૦૮-૦૨-૨૩ના રોજ સચોટ અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો. એ જ દિવસે વલસાડના નિવાસી અધિક કલેક્ટરે વલસાડ રેલવેના એરિયા

મેનેજરને પત્ર લખીને જણાવ્યું હતું કે, વલસાડ પ્રાંત અધિકારીની સચનાથી વલસાડ મા. અને મ. વિભાગના કા.ઇ. તેમજ રેલવેના એ.ડી.ઇ.એન. યોગેશકુમારે સ્થળ મુલાકાત કરી હતી. તેમાં આશરે ૮૦ મીટર જેટલી દીવાલનું સ્ટ્રક્ચર રેલવે વિભાગ દ્વારા દૂર કરી દેવાની ખાતરી આપવામાં આવી હતી. તેમ છતાં આજદિન સુધી લોખંડના સળિયાનું સ્ટુકચર હટાવવામાં આવ્યું નથી. જેથી વલસાડ જિલ્લાની પ્રજા ભયંકર ટ્રાફિકનો સામનો કરી રહી છે તેવો ઉલ્લેખ પત્રમાં કર્યો હતો.

સંદેશના અહેવાલને પગલે વલસાડ રેલવેના

અધિકારી પર ઉપરથી દબાણ આવતા, સંદેશના પ્રતિનિધિને ફોન કરીને તા. ૮મીનો સંદેશનો અહેવાલ કયા તથ્યોને આધારે પ્રસિદ્ધ કર્યો તેની વિગતો માંગવા માંડ્યા હતા. વલસાડના નિવાસી અધિક કલેક્ટરના પત્ર પરથી રેલવેના અધિકારીની લાલિયાવાડી ઉઘાડી પડી ગઇ છે. અંતે રેલવે વિભાગના અધિકારીઓની હેકડી નીકળી ગઇ છે અને આજથી ૮૦ મીટરનું રોડને અડોઅડ કરેલા બાંધકામને દૂર કરવાની કામગીરી શરૂ કરી દેવાતા, લોકોમાં આનંદની લાગણી પ્રસરી ગઇ હોવાનું જાણવા મળે છે.

ડભોઈ ભાષેજનું મોસાળું કરવા જતા પરિવારને લૂંટી લેવાયો હતો પારડીમાં માતા-પુત્ર પાસેથી 3 લાખના લૂંટ પ્રકરણમાં ચાર આરોપી ઝડપાયા

પારડીમાં નેશનલ હાઇવે નંબર ૪૮ ઉપર બે ઈસમોએ ત્રણ લાખ રોકડા લંટી લીધા હતા. આ કેસમાં પોલીસે ૪ આરોપીને ઝડપી પાડી મોટી સફળતા હાંસલ કરી છે.

વડોદરાના ચણવાડા ડભોઇના વતની અને હાલ વાપી ખાતે મેરીલ કંપનીની બાજુમાં રહેતા અને ગેસ કુકર વગેરે રીપેરીંગનો ધંધો કરતા કરણભાઈ વિકલભાઈ વાદી અને તેમની માતા જશીબેન વિક્રલભાઈ વાદી ડભોઇ ખાતે ભાણેજના લગ્ન હોવાથી મોસાળું કરવા માટે રૂપિયા ત્રણ લાખ રોકડા લઈને પોતાની પલ્સર બાઈક ઉપર વાપીથી ડભોઇ જવા નીકળ્યા હતા. જે વેળા

પારડી હાઇવે ઉપરથી હોટલ શ્રીનાથ સામે પાછળથી આવેલા બાઈક ઉપર સવાર બે ઈસમોએ પોતાની ઓળખ પોલીસ તરીકે આપી તેમનું બાઈક રોકાવ્યું હતું અને કાયદા બતાવ્યા બાદ વાતમાં ભોળવી જશીબેન પાસેથી ૩ લાખ રૂપિયા ભરેલી લેડીઝ બેગ લૂંટી લીધી હતી. આ ઘટના હોટલના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ હતી. લૂંટાયેલા પરિવારે પારડી પોલીસને જાણ કરતા પોલીસે તુરંત જિલ્લા પોલીસને એલર્ટ કરી

હતી જોકે લૂંટારૂ હાથ લાગ્યા નહોતા. આ ઘટનામાં ફરિયાદીએ વર્ણવેલી વિગતમાં વીસીમાંથી પૈસા ઉપાડચાનો ઉલ્લેખ હોય. તેથી આ વીસી સાથે સંકળાયેલા કોઈ જાણ ભેદુ હોવાની શંકા સાથે પોલીસે તપાસ હાથ ધરી હતી. દરમિયાન એલસીબીના પી.એસ.આઇ એચ એ સિંઘાને મળેલી બાતમીના આધારે વાપી કચીગામ રોડ ત્રણ રસ્તા પાસેથી ચોરીના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલા આરોપી પૈકી સુનિલ ઉર્ફે પોલુ મણીલાલ સલાટ પણ વીસીનો સભ્ય હોવાથી દર મહિને કોને કેટલા પૈસાની વીસી લાગે છે તેની જાણ તેને

રહેતી હતી. જેથી તેણે કરણભાઈને લૂંટી લેવાનો પ્લાન ઘડી કાઢ્યો હતો અને તેની ટીપ સુનિલ ઉર્ફે હરેશ રમેશભાઈ જોગી તથા તેનો સાળો કમલેશ મંગળભાઈ વાદીને આપી હતી. તેમણે તેના ઓળખીતા મુજબ મિલ ઉર્ફે મુજજુ ઈમ્તિયાઝ ઈબ્રાહીમ ખલીફ્રા તથા આરોપી જાહેર શેખને ટીપ આપી હતી અને ઘટનાને અંજામ આપ્યો હતો. પોલીસે આરોપીઓ પાસેથી રોકડા રૂપિયા ૨, ૧૩,૫૦૦, પાંચ ફોન, મોપેડ નંબર gj ૧૫ dp ૦૪૮૨તથા હોન્ડા યુનિકોન મોટરસાયકલ નંબર જીજે ૧૬ સીજે ૫૧૮૪ કબજે કર્યા હતા.



રૂપિયા 64.84 કરોડની આવક સામે 41.52 કરોડની જાવક

પારડી પાલિકામાં કારોબારી સમિતિની બેઠક: 64.84 કરોડના બજેટને મંજૂરી

વર્તમાન કારોબારી સમિતિની સંભવતઃ અંતિમ બેઠકમાં વિવિધ ચર્ચા

પારડી નગરપાલિકાનું વર્ષ ૨૦૨૩-૨૪નું તૈયાર કરાયેલું અંદાજપત્ર પાલિકાની કારોબારી સમિતિએ વંચાણે લઈ જરૂરી સૂચનો સાથે કુલ રૂપિયા ૬૪.૮૪ કરોડનું સિલક રૂપિયા ૨૯,૫૨,૯૦,૪૦૧ સામાન્ય સભામાં રજૂ કરવા મંજૂર કરાયું હતું.

ટંડેલના પ્રમુખપણા હેઠળ પાલિકાના આવી હતી. જેની સામે વર્ષ ૨૦૨૩- મિટિંગ મળી હતી.

સભાખંડમાં એક બેઠક મળી હતી. ૨૪માં વિવિધ કામો માટે રૂપિયા જેમાં સમિતિના તમામ સભ્યો હાજર ૪૧,૫૨,૩૧,૧૭૫નો અંદાજિત રહ્યા હતા. આ બેઠકમાં વર્ષ ૨૦૨૩- ખર્ચ ૨જૂ થયો હતો. આમ રૂપિયા ૨૪નું તૈયાર કરાયેલું અંદાજપત્ર ૨૩,૩૨,૫૧,૪૧૬ની પુરાંતવાળું વંચાણે લેવામાં આવ્યું હતું. જેમાં બંધ ઉપરાંત વર્ષ ૨૦૨૩-૨૪ની વિવિધ ગ્રાન્ટ તથા સ્વભંડોળની આવક પારડી નગરપાલિકાના કારોબારી ૩૫,૩૧,૯૨,૧૯૦ મળી કુલ સમિતિના અધ્યક્ષ ગજાનનભાઈ ૬૪.૮૪કરોડની આવક અંદાજવામાં હોય, આ કારોબારીની આ અંતિમ

બજેટ સામાન્ય સભામાં લઈ જવા માટે મંજુરી અપાઈ હતી. આ ઉપરાંત ત્રિમાસિક હિસાબનો પણ વંચાણે લઈ બહાલી અપાઈ હતી. વર્તમાન બોર્ડની મુદ્દત ૧૬ ફેબ્રુઆરીએ પૂર્ણ થનાર

દેગામ પાસે કંપનીના કર્મચારી પર હુમલો

ચીખલી દેગામમાં ઓવરબ્રીજના ભાગે ઈજા પણ થઈ હતી.

સર્વિસ રોડ પર ખાનગી કંપનીના કર્મચારીની કાર આગળ પોતાની કાર ઉભી રાખી બે અજાણ્યા શખ્સો ઉતરી તુ બો કંપની ચલાવે છે તેમ કહી ફટકા મારી ધમકી આપી ફરાર થઈ જતા ચીખલી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. કંપનીમાં ફરજ પૂર્ણ કરી તેમની ક્રેટા કારમાં સુરત જવા નીકળયા હતા. આ દરમ્યાન નેશનલ હાઈવેના દેગામ રેલ્વે ફાટક ઓવરબ્રીજની સર્વિસ રોડ ઉપર એક સફેદ કલરની ગાડીના ચાલકે રિર્વસ કરી તેની આગળ ગાડી મુકી આડશ ઉભી કરતા મારી ગાડી કેમ રાકેલ તેમ પુછતા આ ગાડીમાંથી ઉતરેલ અજાણ્યા શખ્સે જણાવેલ કે તુ બો કંપની ચલાવે છે અને હાથમાં વાંસની લાકડી વડે ચારેક સપાટા મારતા અંગુઠાના

સુરત મહાનગરપાલિકા સાઉથ વેસ્ટ (અઠવા) ઝોન આકારણી અને વસુલાત વિભાગ



સાઉથ વેસ્ટ (અઠવા) ઝોન વિસ્તારમાં આવેલ મિલકતદારોનાં બાકી મિલકતવેરા વસુલ કરવા અંગેની જાતેર નોટિસ સંબંધિત મિલ્કતો/ બંધ મિલ્કતો/ ખુલ્લા પ્લોટના માલિક/ ધારણકર્તા/ કબ્જેદાર/ હિત ધરાવતા પક્ષકારો જોગ

સુરત મહાનગરપાલિકાનાં સાઉલ વેસ્ટ(અઠવા)ઝોન વિસ્તારમાં આવેલ વીચેની વાદીમાં જજાવેલ મિલકતદારોને સને ૨૦૨૨ -૨૩નાં વર્ષનાં મિલકતદાનો બીલો ચોકલવામાં આવેલ છે. ત્વારપાદ બીલ ભરપાઈ કર્યા માત્ર વાત્ર પાત્ર કર્યા હતા બાદ જો. તેને એક પ્રકલ્ય ન્ડ બન્યાર કરવેલના નિયમો પાત્ર કર્યા પાત્ર કર્યા હતા તેને માત્ર કર્યા હતા તેને કર્યા જે તેને સાથ્ય કર્યા હતા તેને સાથ્ય કર્યા હતા તેને સાથ્ય કર્યા હતા તેને સાથ્ય કર્યા હતા તેને સાથ્ય કરા સાથ્ય કરા સાથ્ય કરા સાથ્ય કરા સાથ્ય કરા તેને ભરપાઈ કરવા અંતિય તક આપવામાં આવે છે. અન્યા જી.પી.એમ.સી. એક્ટ સને ૧૯૪૯ કલમ ૪૬૬ (૧લી)માં જણાવેલ જોગવાઈએને સાથ્ય જોને સાથ્ય કર્યા હતા તેને સાથ્ય કરા સાથ્ય કર્યા કર્યા હતા તેને સાથ્ય કરા સાથ્ય કરવા સાથ્ય કરા સાથ્ય કરવા સાથ્ય કરા સાથ્ય કરવા સાથ્ય કરવા સાથ્ય કરવા સાથ્ય કરવા સાથ્ય કરવામાં આવેલ કરવામાં આવેલ કરવા સાથ્ય કરવાનો કરવામાં આવેલ જોગ તરીકે દાખલ કરવામાં આવેલે કેને કરા સાથ્ય કરવા સાથ્ય કરવાનો કરવામાં આવેલે કરવામાં સાથ્ય કરવામાં આવેલે કરવામાં સાથ્ય કરવામાં સાથ્ય કરવામાં સાથ્ય કરવામાં આવેલે કરવામાં આવેલે કરવામાં સાથ્ય કર્ય કરવામાં સાથ્ય કરવામાં સાથ્ય કરવામાં સાથ્ય કર્ય કર્યા સાથ્ય કરવામાં સાથ્ય કરવામા સાથ્ય કર્ય કરવામાં સાથ્ય કરવામાં સાથ્ય કરવામાં સાથ્ય કરવામાં સાથ્ય કરવામા

| ¥. | ટેના.નંધર/નાથ | વિશકતની વિગતો | ઉપયોગનો પ્રકાર | બાહી વિશ્વક વેરાની રક્ષ ૦૮/૦૨/૨૦૧૩ દિનન રોજ | 70 | ૮૩એ-૦૫-૮૪૭૫-૦-૦૦૧ મે. માઈલ સ્ટોન કન્સ્ટ્રક્શન યાર્ટનસ્ક્રીય ફર્મ | ઓકીસ નં. ૩૦૫, માઈલ સ્ટોન મિલાગો, વાત્સલ્ય બંગ્લોઝની બાજુમા, ઉપના મગદલ્લા સોડ,સરત | ઓકીસ | 1,00,00.00 | | | | | | | | | | | |
|-----|---|--|--|--|-----|--|---|---|---|---|------|-------------|--|--------|----|--------------------------------------|--|--|---------------------------|-------------|
| | 604-04-1451-0-001 604-04-1544-0-001 604-04-1551-0-001 | 01 01 01 01 01 01 01 01 01 01 01 01 01 0 | | | | | | | | | | | | - 1333 | | 43 | ૮૩એ -૧૧-૧૧૬૧-૦-૦૦૧ પગદલ્યા છે.ઓ.પા.સોક્ષપટી પશુપક્ષી/ સેકેટરીક્રી | મેંગવમ યાર્ક એ,કીંગ ટાનર પાસ, વેસ, સુરત | રેસીકન્સ એન્ડ ઓક્સિ | 4,04,804.60 |
| | 200-04-1987-0-001 200-0-1981-0-01 200-0-1981-0-01 200-0-1831-0-00 200-0-1831-0-00 | | ર૩,૩૬,૩૯,૨૫, ૫૬,૧৯,૬૯, ૧૦,૦૩, જુવલભી ભંગ્લોઝ, | | | 45 | ૮૩એ-૧૫- <i>૬૮૬૫-૦-૦</i> ૦૧ શ્રી સંકુર બઘરાજ વારવ | મ્લોકિસ નં. ૨૧૦, વીઆઈપી કાઈ સ્ટ્રીટ, ફુંગટા શોપીંગ સેન્ટરની સામે, વી.અટઈ ,પી.રોદ, વેસ, સુરત | ઓકીસ | 4, 64, 892, 94 | | | | | | | | | | |
| | 204-04-1224-0-001 203-04-1601-0-001 203-04-1614-0-001 203-04-1644-0-001 | | | | | | | 74 | ૮૩એ-૧૫- <i>૬</i> ૯૨૧-૦-૦૦૧ શ્રી દીષક ભવરાજ નારંગ | ઓક્સિનં. ૩૧૦, વીઆઈપી લાઈ સ્ટ્રીટ, ડ્રંગણ શોપીંગ શેન્ટરની લાખે, વી.આઈ .પી.રોડ, લેસુ, સુરત | ઓકીલ | 1,00,894.33 | | | | | | | | |
| | 60%-04-1651-0-001 60%-04-1664-0-001 60%-04-3031-0-001 60%-04-3031-0-001 60%-04-3051-0-001 | | | ઓપન પ્લોટ | | 41 | ૮૩એ -૨૧ -૨૩૦૧ - ૦-૦૦૧ ૧ પોલારીશ વર્લ્ડ પાર્ટનરસીપ કોર્પ પાર્ટનર શ્રી માવચંદભાઈ વશરાયભાઈ ભગત શ્રી મંજુલાલેન માવપંદભાઈ ભગત | રે.સ.નં.૧૩૫, ટી.પી.૦૫, એક.પી.૧૮ પૈકી પ્લોટ નં. એ/૧, (વેસુ–ભીમરાર) કોર પોઈન્ટ્ સામે, તી.આઈ .પી.રોડ,વેસુ, સુરત. | કોર્ગ.ઓપન પ્લોટ | 4,41,488.33 | | | | | | | | | | |
| | 60% - 04-2061 - 0-001 60% - 04-2111 - 0-001 60% - 04-2131 - 0-001 60% - 04-2121 - 0-001 | | | | 100 | ૮૩એ -૨૧-૨૬૨૧-૦-૦૦૧ શ્રી ૧-સુખભાઈ દારોરભાઈ વિવેર | રે.સ.નં. ૧૫૧/ર, ૧૫૨/ર, ૧૫૨/૩, એક.પી.નં.૭૦/ર, વેલુ, સુરત | ઓપન પ્લોટ | 9,10,402.49 | | | | | | | | | | | |
| 4 | 20%-04-216%-0-001 20%-04-2361-0-001 20%-04-2361-0-001 20%-04-281%-0-001 20%-04-281%-0-001 | | | 46,75,950.14 | 40 | ૮૩એ-૨૧-૩૦૩૮-૦-૦૦૧ શ્રી સુરેન્દ્ર શાંતિલાલ શેડ વિગેરે કમ્મેદાર :- શ્રી બલોકભાઈ વી. ધર્મન્ટ એન્ડ શ્રી લલિતકૃપાર એ.ખાલીશી | કટ, લાંતિનિકેતન સોસાવડી, સુયુલ દેરી રોડ, સુરત | ઓપન પ્લોટ (રેસીડન્સ) | 1,10,000.00 | | | | | | | | | | | |
| | 204-04-2861-0-001 204-04-2401-0-001 204-04-2461-0-001 | | | | 46 | ૮૩મેં -૨૧- ૧૭૨૧- ૦-૦૦૧ થી જનકભાઈ વીરજીભાઈ પટેલ | રે.સ.નં.હપહાન તાલુકો—ચોર્યાસી, વેસુ, સુરત. | રેલી. એન્ડ ઓકીસ | 4,04,683.00 | | | | | | | | | | | |
| | 204-04-2501-0-001 204-04-2501-0-001 | પ્લોટ નંધર – ૮૧, ૮૬, ૮૯. | | | 90 | ૮૩એ-૨૧-૧૮૫૧-૦-૦૦૧ શ્રી પંસામેન ધનસુખભાઈ | રે.સ.નં. ૩૬૧/પી, તાલુકો યોવોસી, વેસુ, સુરત | ઓપન પ્લોટ | 4,40,000.F1 | | | | | | | | | | | |
| | 503-04-3518-0-001 503-04-3538-0-001 503-04-3538-0-001 503-04-3538-0-001 503-04-3538-0-001 503-04-3538-0-001 503-04-3538-0-001 503-04-3588-0-001 | 50, 62, 66, 403, 404, 404, 404, 404, 404, 404, 404 | MIS | , વલ્દ, વર્ક્ટર્ગ ૧૩૮ ૧૮૩, ૨૦૧, ૧૮૩, ૨૦૧, ૧૯૩, ૧૧ માર્ક | | 21 | ૮૩એ-૨૧-૭૯૩૧-૦-૦૦૧ શ્રી રપેશબાઈ કેશનબાઈ કાછડીયા શ્રી ભાતભાઈ વલ્લમભાઈ પટેલ (નારોલા) | ૫૦૨, વીલસન ટાવર, વોડદોક રોક, સુરત રે.સ.નં. ૨૮૩/૧ પૈકી પ્લોટ નં. ૨ વેસુ, સુરત | ઓપન પ્લોટ | 9,40,406,24 | | | | | | | | | | |
| | | | | | | æ | ૮૩એ ૨૧ ૭૯૪૧ ૦-૦૦૧ થી પારૂલ ઉપેશમાઈ સ્થામી | એક-૧/બી, સોમનાથ મહાદેવ સોસાયટી, સરચમ શોપીંગ સેન્ટર પાછળ, પાર્થ પોઈન્ટ, સુરતારે, સ.નં. ૨૮૩/૨ પૈકી પ્લોટ નં. ૩, વેશ, સરત | ઓપન પ્લોટ | 9,40,000.03 | | | | | | | | | | |
| | | | | | | | | | | | | | | | 93 | ૮૩એ-૨૭-૦૯૫૧-૦-૦૦૧ રત્ન ઓર્સેનાઉઝર | રે.સ.નં. ૪૮, એક.પી.નં.૧૨૦ વેડી ર, દી.પી.૧ ઓપન પ્લોટ ટાવર–સી. રવિ રત્ન એપાર્ટમેન્ટ, વેસિક રેસીડન્લી નથીદ, સોમેશ્વરા, વેસુ, સુરત | ઓ કીસ | Hickory Co | |
| | હસમુખલાલ થોદી (બેંગ.યુ.એફ) ૮૧એ - ૯૫ - ૧૭૩૧ - ૦ - ૦૦૧ ૨૯૧૬ભા કો. ઓ.તાઉસીંગ સોસાવટી(ઉપ્પીરર ટાઈપ) | ઈ–૨૬, સ્ત્નપ્રભા કો.ઓ.ઠાઉસીંગ સોસાવટી (ઈચ્ચીરર ટાઈપ)(સોયેલ્નર | ઓપન પ્લોટ | 9,05,096.90 | 21 | ૮૩એ-૨૭-૭૩૦૫-૦-૦૦૧ આગ્ય એન્ટરપ્રાઈઝ | દુકાન નં. ૪૩, બીજો માળ, આરામ આર્કેડ, જોલી રેસી.ની સામે, વેસુ મેઇલ રોડ, વેસુ, સુરત. | સોપ | 9,00,483.60 | | | | | | | | | | | |
| 1 | (श्रोमेश्वर मेन्डबंब) ८१मेन ०९-२१९९१ - ०-००९ ६६७ संस्कृत सेटर टेन्ड मेन्ड नेसीडन्स | એ-કહેવ), બરથાણા, વેસુ , સુરત રત્વપ્રભા કો.ઓ.હાઇસીંગ સોસ્પ્યટી(ઇમ્પીરરટાઈપ) (સોચેશ્વર એ-કહેવ), બરથાલા, વેસુ , સુરત | (ইর্মাচন্দ্র) গ্রীকলাক | CCONSTRI | ei | ૮૩એ -૨૯-૯૦૬૧-૦-૦૦૧ લેગીના અલ્વેશ શાહ કોર્રેક્ટર :- અલ્વર્સગ કોટસ્પીન પા.શિ. માહત :- પ્રેચર્સ કીડબેસ એડર્વ-વર્સ પા.શિ. | દુકાન નં. ૧૦૧, પહેલો માલ, | શોષ | 4,00,040.00 | | | | | | | | | | | |
| * | દરએ - ૦૫ - ૪૪૭૧ - ૦ - ૦૦૧ શ્રી હિચ્ચતભાઈ બાબુઆઈ સોરક્રિયા વિગેરે પાર્ટગર ઓફ હેપ્પી હોય કોર્પોરેશન | રે.ધ.નં. ૧૦/૧, બ્લોક નં. ૧૦૫/એ, દી.ધી.નં.૧૩, એક.ધી.નં.૧૦૯, ભરથાલા, તેસુ, સુરત | ઓપન પ્લોટ | h,24,483.4e | 86 | ૮૩એ -૩૩-૦૧૫૫ -૦-૦૦૧ થી શરેશ સોલ્વલલ જોવલ | રે.સ.નં.રછ૦, ટી.પી.૦૬, એક.પી. ૦૩, બીક્સ નં. ૧૧૨થી ૧૧૫ (જૂની) ૧૦૪ (નવો) ત્રીજો થાળ, વેસ્ટકીલ્ટ | 500 | 9,04,043.04 | | | | | | | | | | | |
| * | દરએ-૦૫–૫૦૮૧–૦-૦૦૧ થ્રી બીખુબાઈ રજાછોરભાઈ દાબી | રે.સ.નં. ૮૧/૧ + ૮૨/૧, ભ્લોક નં. ૧૭૪, એક.પી.નં.૧૦૮, ટી.પી.૧૩, | ઓપન પ્લોટ | 9,93,900.08 | | | રકવેર, આગમ જોપીંગ વર્લ્ડ સાથે, વેગુ, સુરત રે.સ.નં.૪૪, ઠી.પી.૧૬, | | | | | | | | | | | | | |
| | ૮૩મે - ૦૧ – ૧૬૪૧ – ૦ - ૦૦૧ શ્રી તર્પદમાઈ દલાભાઈ | ભરવાલા, વેસુ, સુરત રોતીત કચિયુ,વેસુગામ, સુરત | ઓવન પ્લોટ | V,30,183.m) | 50 | | વૈકી સબ પ્લોટ નં.૦ ૨,ઓક્સિ નં. ૧૦૧, નીજો માળ, સોમેન્વર સ્કવેર, | હોસ્પીટલ, દેશન | 9.10,154.00 | | | | | | | | | | | |
| 10 | ૮૩એ-૦૧-૨૪૦૧-૦-૦૦૧ શ્રી રૂસ્ત્રપત્રી પરસોતપત્રી ક્રમ્ત્રદાર :- શ્રી નવીનભાઈ છીમકાભાઈ | રપદ/૧, મુદિર દળિયુ, નેસુ ગામ ,સુરત | ગોલઇન | 186,000,0 | | u.Dt. | આગમ હેરીટેજ સાથે, સોમેલ્વરા એન્કલેવ નજીક, વેસુ, સુરત | 2 | | | | | | | | | | | | |
| 4 | ૮૩એ-૦૧-૨૬૪૧-૦-૦૦૧ થી ૦૦૬ થી લીલાયેન દયાભાઈ સોલંકી | ક્ષ્મનાસ,વેસુગામ,સુરત હરીજનવાસ,વેસુગામ,સુરત | રે સીદ-સ | п,йе,лок пр | 36 | ૮૩એ -૩૫-૦૮૫૧-૦-૦૦૧ થી તેજસ રાષ્ટ્રાભાઈ કેર | રે.સ.નં.૪૪, ટી.પી.૧૬, પૈકી સમ પ્લોટ નં.૦૨, ઓક્કિલ નં. ૨૦૨, ગોગો મામ, સાંપેન્યર સહેર, આગમ હેરીટેજ સાથે, સોર્યેન્વરા | ઓદીસ | 1,05,808.80 | | | | | | | | | | | |
| 4 | 23એ-03-802૧-0-00૧ શ્રી ધર્મેસભાઈ છવનમાઈ માવનીવા | ગામતળ પૈકી ઘર નં. ૨૨૬૦/૨૨૬૮, હળપલિવાસ, વેસ,સસ્ત | ઓપન પ્લોટ | nac, euc es | | | એન્ડલેવ વર્લીક, વેસુ, સુરક્ષ રે.સ.નં.૭૧૪ પૈકી એક.પી.૧૮, ટી.પી.૦૬ | | | | | | | | | | | | | |
| 90 | ૮૩મે ૦૫ ર૧૯૧ ૦ ૦૦૧ શક્તિવિષય કો.ઓ.સા.સો.સિ. | પ્લોટ નંબર ૮,૯,૧છ શસ્ત્રિવિજય કો.ઓ.તા.સો.ચિ. | ઓપન પ્લોટ | 4,28,1981.08 | 26 | ૮૩એ-૩૫-૧૫૯૧-૦-૦૦૧ કરી દેવન શ્રવિક ચાવાવાલા | ઓફિસ એક/૧, ત્રીજો માળ, ક્ષિત્રકાર્તિક એન્કલેવ, શૂંગાર રેશ.ડન્સી બાજુમાં, સ્થામ પેલેસ સામે, તેસુ–આભવા | ઓકીસ | 9,50,5EH.01 | | | | | | | | | | | |
| 111 | ૮૩મ - ૦૫ - ૨૨૩૧ - ૦ - ૦૦૧ શક્તિવિજય કો.ઓ.ઘ.મો.લિ. | પ્લોટ નંબર ૧૪,૧૮ શક્તિવિજય કો ઓ.સ.સો.ચિ. | ઓપન પ્લોટ | 9,85,980.04 | - | | રોડ, વૈશુ, ગુરત | 401 144 | 90.88,00C.89 | | | | | | | | | | | |

(૧) આ જાઈર નોટીસની પ્રતિધ્ધિ દરમ્યાન ઉપરોક્ત વિવક્તો પૈકી જે વિવક્તનો મ્યુ. ટેશ ભરવાઈ કરવામાં મુખ્યાં તોય તો જે તે મિવકતદારે આ જાઈરનોટીસને રહયાતલ સમજવી. (૨) સાઉપ વેસ્ટ (મહવા) એનમાં સુમાવિષ્ટ તમામ વોર્ડના ખીલો ઉસ્લુ થઈ ગયેલ તોવાથી જે કરદાતાની વિવકતોનો મ્યુ. વેરો,પાણી વેરો તથા પ્રોફેશનલ ટેશ બાકી તોય તે તાકીરે નં.પી.આર.આં/૭૬૬/૧૦૧૨-૧૩ . I/C સીંટી ઉજનેર લેનલ લીક (અઠકા ઝોન) શુરત મહાનગરપાલિકા

સંદેશ વિશેષ

ધરમપુર નગરપાલિકા સંચાલિત લાઇબ્રેરીને એવોર્ડ એનાયત

ધરમપુર : રાજ્યના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગના ગ્રંથાલય વિભાગ, ગુજરાત રાજ્ય દ્વારા માન્યતા પ્રાપ્ત અનુદાનિત ગંથાલયો માટેની સ્વ. શ્રી મોતીભાઈ અમીન ગંથાલય સેવા અને ઉત્તમ ગ્રંથાલય સેવા પ્રમાણપત્ર અન્વયે સને ૨૦૧૮માં સ્પર્ધા રાખવામાં આવી હતી. જે સ્પર્ધામાં ધરમપુર નગરપાલિકા સંચાલિત એસ.એમ.એસ.એન. બાળ લાઈબ્રેરીને તથા એના ગ્રંથપાલ નિમેષ ભટ્ટને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. વિજેતા ગ્રંથાલય, તેના ગુંથપાલ નિમેષ ભદ્ર તથા બાળ લાઈબ્રેરીના સંચાલક મંડળ ધરમપુર નગરપાલિકાને પારિતોષિક અને પ્રમાણપત્ર આપવાનો કાર્યક્રમ તા. ૧૦ ફેબ્રુઆરીના રોજ ગાંધીનગર ખાતે રાખવામાં આવ્યો હતો. ગુજરાત સાહિત્ય અકાદમીના મહાપાત્ર જયેન્દ્રસિંહ જાદવના અધ્યક્ષપણા હેઠળ તથા ગ્રંથાલય નિયામક ડો. પંકજભાઈ ગૌસ્વામીની ઉપસ્થિતમાં આયોજિત કાર્યક્રમમાં એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો. પાલિકા સંચાલિત બાળ લાઈબ્રેરીને ગુજરાત સરકાર તરફથી એવોર્ડ મળતા સમગ્ર ધરમપુર વિસ્તારના પુસ્તક પ્રેમીઓ અને પ્રબુદ્ધ નાગરિકોમાં આનંદની લાગણી ફેલાઈ છે.

ગોઈમા મુખ્ય પ્રાથમિક શાળામાં આર.ઓ.પ્લાન્ટનું લોકાર્પણ કરાયું





વાપી : ગોઈમા ગામે સોમવારના રોજ મુખ્ય પ્રાથમિક શાળામાં ગોઈમા જિ. પંચાયત સભ્ય અને શાસક પક્ષના નેતા શૈલેશકુમાર આર. પટેલની જિ. પંચાયતના ૧૫મા નાણાપંચની વર્ષ ૨૦૨૦/૨૧ની ગ્રાન્ટમાંથી રૂ. ૨૫૦૦૦૦ અંકે રૂપિયા બે લાખ પચાસ હજારની ગ્રાન્ટ આર.ઓ.પ્લાન્ટ માટે ફાળવાઈ હતી. જેનું કામ પૂર્ણ થતા સોમવારે એનું લોકાર્પણ શાસકપક્ષના નેતા શૈલેશકુમાર પટેલ, તાલુકા પંચાયત સભ્ય ભારતીબેન પટેલ, સરપંચ પતિ મિતેશભાઈ અને જયેશભાઈ, દીપકભાઇ, આચાર્ય કમલેશભાઈના હસ્તે કરવામાં આવ્યું હતું. શાળાના ધોરણ, ૧થી ૮ના ૨૪૧ વિદ્યાર્થીઓને શુદ્ધ પીવાનું પાણી મળી રહેશે. શૈલેશકુમાર પટેલ અને તા.પં. સભ્ય ભારતીબેનના પ્રયત્નોથી ગોઈમા મુખ્ય પ્રાથમિક શાળા માટે કમ્પાઉન્ડ વોલ. આર.ઓ. પ્લાન્ટ, સાંસ્કૃતિક હોલ, ટોઇલેટ બાથરૂમ, લાઇબ્રેરી માટે ૧૯૫૦૦૦૦ (ઓગણીસ લાખ પચાસ હજાર)થી વધુની ગ્રાન્ટ ફાળવાઈ છે. હજી પણ ખૂટતી તમામ સુવિધાઓ પૂર્ણ કરી આપવાની ખાતરી આપી હતી. જે બદલ સરપંચ જ્યોતિબેન અને શાળાપરિવારે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

નંદીગામમાં કલ્યાણ સાગરસૂરીશ્વરજીની ગુરુ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનો આરંભ થયો



પ્રથમ દિને કુંભસ્થાપન, અંખડદીપક દ્વારા ઉમરગામ તાલુકાના નંદીગામ ખાતે મૂર્તિ પ્રતિષ્ઠાનો

રોપણ, દશદિક પાલ, નવગ્રહ, અપ્ટમંગલ ઓસિયાજી મહાતીર્થમા આચાર્ય ભગવંત પાટલા પૂજન, અઢાર અભિષેક વિધિ, કલ્યાણસાગરસૂરીર્શ્વરજી મહારાજની ગુરુ ગુરુમૂર્તિ-ધ્વજદંડ-કળશ વિધાન, સંયમ પ્રથમ દિને કુંભ સ્થાપન, વંદનાલી કાર્યક્રમ હતાો.

િરા દિલા સાીયા અખંડ દીપક દ્વારા રોપણ, મહોત્સવની ઉજવણી યોજાયો શરૂ થઈ હતી. જેમા **દશદિક પાલ, અઢાર અભિષેક** માહો ત્સાવામાાં લાભાર્થી પરિવાર અને વિધિકારક હર્ષિલ વગેરે કાર્યક્રમ યોજાયા જૈન અજૈનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

શાહ અમદાવાદ અને વિરમગામનુ પ્રખ્યાત ઢોલ નંદીગામ ઓસિયાજી મહાતીર્થમા શાહનાઈવાદન હતું. આ સમગ્ર આચાર્યભગવંતકલ્યાણસાગરસૂરીર્શ્વરજી 🔝 કાર્યક્રમનો લાભ સુધાબેન અરવિંદ શાહ મહારાજ સાહેબની ગુરુ મૂર્તિ પ્રતિષ્ઠાના પરિવાર (દહેગામવાળા)એ લીધો હતો.

જાહેર નોટીસ

आ**शी कढेर क्वताने क्**शाववानुं डे मोके भागडावडा ता.जु. ववसाड मा આવેલ બ્લોક સ.નં. ૫૪૬૪ જેનો જુનો બ્લોક સ.નં. ૯૫૨/પૈકી -૪૩ મા આવેલ પ્લોટ તાં. ૪૯ જેતુ માપ ૨૫૫ શો.મી. છે આ મિલકત સંબંધે ગુભલસ્ત્રી ઓનર્સ એઓઓએશન (વલસાડ) NTC Res No. G-૪૦૦૬ તા. ૧૦-૬-૯૧ તરફથી હર્ષદભાઇ હરીભાઇ પટેલના લાભમાં તા. ૨૫-૩-૨૦૦૩ ના દિને શેર સર્ટીફીકેટ નંબર ૨૪ (શેર નંગ-૧) કાળવવામાં આવેલો હતો. જે શેર સર્ટીફીકેટ કર્યાક ગુમ થયેલ છે, અસલ શેર સર્ટીફીકેટ મળી આવતો નથી જેથી જે કોઈ વ્યક્તિને સદરહું ગુમ થયેલ શેર સર્ટીફીકેટ મળે તો તેની જાણ દિન-હમાં નીચે જણાવેલ સરનામે કરવી.

आ मुद्दत वित्था आह सहरहु गुम यथेल शेर सर्टीढ़ीडेट लडल मेजवपा અંગેની કાર્ચવાહી કરનાર છે. જેવી સદસ્તુ મુદ્દત બાદ કોઈ પણ વ્યક્તિનો વાંધા ક્લુલ રાખવામાં આવશે નહી. જેની જાહેર જનતાએ નોંધ લેવી.

જ્યાબેન હર્ષદભાઈ પટેલ ક્શાભીવાડ, આમઘરા, તા. ચીખલી. જી. નવસારી.